॥ સનાતન પરમો ધર્મ ॥
પ્રચાર પ્રસાર
સનાતન ધર્મ પત્રિકા
જાગૃત ઉજાગર
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર
This edition is for internal circulation of members of ABKKP Social Association
SOCIAL MEDIA USE ONLY
સ્થાપના:
સં -૨૦૮૦ | શ્રાવણ સુદ -૮ | તા.૨૪-૦૮-૨૦૨૩ | ગુરુવાર | SDP No.: 1217 | MOB.:+91 7801877774, +91 7718977774 | ankasantandharmpatrika@gmail.com

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ ૧૭ માં અને સ્વર્ણિમ ટર્મની દ્વિવાર્ષિક સામાન્ય સભા:

યુવા મંડળ ની ભારતભરમાંથી આવેલી યુવા મેદની, અદભુત જોશ અને જુસ્સો, ભવ્ય માહોલ, નવા આગોવાનોની ઘોષણાનો ઇંતજાર અને સૌ યુવા કાર્યકર્તાઓના અદમ્ય ઉત્સાહ સાથે દ્વિવાર્ષિક સામાન્ય સભા નાં સત્ર ની સફળ શરૂઆત...

વડોદરા નાં યુવા મંડળ ન્યુ vip રોડ ની દીકરીઓ એ સુંદર ઉત્સાહ પૂર્વક સ્વાગત નૃત્ય કરી સહુ ને કપાળે તિલક કરી આમંત્રણ આપ્યું..

તારીખ ૨૦ ઓગષ્ટ, ૨૦૨૩ ને રવિવારે સરદાર પટેલ રીજીયનની યજમાનીમાં વડોદરા ખાતે પવિત્ર ત્રીમંદિરના રમણીય વાતાવરણમાં યુવાસંઘ ૨૦૨૧-૨૩ જેને સ્વર્ણિમ ટર્મ પણ કહી શકાય તેની દ્વિવાર્ષિક સામાન્ય સભા સવારે ૮.૩૦ વાગ્યે પ્રારંભ કરવામાં આવી.

આગલા દિવસથી જ સર્વ યુવા મિત્રોમાં અનેરો ઉત્સાહ છલકાતો હતો. કેન્દ્રીય સમાજના આગેવાનો, ૨૩ રીજીયનના હોદ્દેદારો, સેન્ટ્રલ કેબિનેટ

૨૦૨૧-૨૦૨૩ ના કાર્યકાળ ના સેન્ટ્રલ પ્રેસિડેન્ટ- જનરલ સેક્રેટરી- વાઇસ પ્રેસિડેન્ટ ૧૮ મી નવી ટીમ ને જવાબદારી સોંપવા નો ઉત્સાહ જતાવી રહ્યા છે...

મેમ્બર્સ, સ્થાનિક આગેવાનો અને અન્ય કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજરી નોંધાવી. દરેકએ રજિસ્ટ્રેશન કરાવી અનેરા ઉમળકા સાથે સભાનું ડેકોરમ જળવાય એ રીતે ભગવાનના સાનિધ્યમાં ભવ્ય ઓડિટોરિયમમાં સેન્ટ્રલ પ્રેસિડેન્ટ અને મુખ્ય હોદેદાર સ્થાન ગ્રહણ કરવામાં આવેલ.

ડોક્ટર વસંત ધોળું નાં અચાનક થયેલ અવસાન બાદ પ્રથમ જનરલ સભા જેમાં તેનો અવાજ નથી છતાં તેની પ્રતીતિ કરવા સહુએ તેમના કર્મઠ અંદાજ ને સદભાવના વ્યક્ત કરી....

સંચાલનનો દોર સેક્રેટરી નિલેશ સુરાણી એ સંભાળ્યો. વડોદરા ની સ્થાનિક સમાજની દીકરીઓએ આહલાદક પ્રાર્થના

ટર્મ ૨૦૨૩-૨૫ માટે કેન્દ્રીય યુવાસંઘ નું નેતૃત્વ જેના શિરે છે એવા સેન્ટ્રલ પ્રેસિડેન્ટ CA. પંકજ પારસિયા નું સભા સમક્ષ પ્રથમ સંબોધન..

નૃત્ય રજૂ કરી કાર્યક્રમની સૂરીલી શરૂઆત કરી.

સભાના અધ્યક્ષ સેન્ટ્રલ પ્રેસિડેન્ટ હિતેશ રામજીયાણી તેમજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઈ ભગત સાથે યુવાસંઘના મુખ્ય હોદ્દેદારોએ દીપ પ્રજ્વલિત કરીને સભાની શુભ શરૂઆત કરી. સેક્રેટરી નિલેશ સુરાણીએ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રીશ્રી, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘના કેન્દ્રીય પ્રેસિડેન્ટ હિતેશ રામજીયાણી, વાઈસ પ્રેસિડેન્ટ અને મિશન ચેરમેન નટવર સામાણી, સેન્ટ્રલ જનરલ સેક્રેટરી ભરત છાભૈયા સાથે મુખ્ય હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, પસંદગી સમિતિના સભ્યોને મંચ ઉપર અને આગલી હરોળમાં સ્થાનગ્રહણ

સપથ ગ્રહણ ટર્મ ૨૦૨૩-૨૫ ની કેન્દ્રીય યુવાસંઘ ની સંપૂર્ણ ટીમ, મિશન લીડર અને સમીતી લીડર,

કરાવ્યું.

ઉપસ્થિત સર્વેના શાબ્દિક આવકાર અર્થે સરદાર પટેલ રીજીયનના તત્કાલીન ઇમિડીએટ પાસ્ટ ચેરમેન જગદીશ લીંબાણી ને સ્વાગત પ્રવચન માટે અનુરોધ કર્યો. આપણી વચ્ચેથી ક્યારેય ન પુરી શકાય એવો ખાસનો ખાલીપો આપીને હરહંમેશ માટે વિદાય લઈ ચૂકેલા છતાં સૌના દિલમાં પરોક્ષ રીતે હાજર એવા સ્વ.ડૉ. વસંતભાઈ ધોળુ તેમજ દક્ષિણ કર્ણાટક રીજીયન નાં સ્વ.કિશોર સુરાણી તેમજ અન્ય સમાજીક સેવા પ્રદાન કરતા શુભ હીતચિંતક એવા પરીવાર નાં સૌ દિવંગત આત્માઓને યાદ કરીને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવા સેક્રેટરી એ સભાને અનુરોધ કર્યો.

નખત્રાણા ખાતે યોજાયેલ ગત સામાન્ય સભાની મિનિટ્સ નું વાંચન સેક્રેટરી નિલેશ સુરાણી દ્વારા કરાયું અને સભાએ સર્વાનુમતે હાથ ઉપર કરી બહાલી આપી. યુવા સુરક્ષા કવચ યોજના (YSK) ના હિસાબોનું વાંચન કરવા YSKની આખી ટિમ મંચ પર ઉપસ્થિત થઈ અને એકદમ સરળ ભાષામાં હિસાબોનું વાંચન કરીને સૌની બહાલી મેળવી.

યુવાસંઘના હિસાબોનું વાંચન

તત્કાલીન ipp ડૉ.વસંત ધોળું નાં દિવંગત થયે તેમના નાના સુપુત્ર ને તેમની સ્મૃતિ ભેટ અર્પણ અને સામૂહિક કર્મયોગી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.

કરવા ટ્રેઝરર લક્ષ્મણ અને જોઇન્ટ ટ્રેઝરર દિનેશ રવાણી ને અનુરોધ કરવામાં આવ્યો અને તેઓએ પણ ખૂબ જ પારદર્શકતા સાથે હિસાબો રજૂ કરી સભાની બહાલી મેળવી. કેન્દ્રિય શ્રીસમાજના મહામંત્રીશ્રી પુરુષોતમ ભાઈ ભગત ને આશીર્વચન માટે વિનંતી કરવામાં આવી, જેમાં સનાતની શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં યુવાસંઘના કાર્યકર્તાઓની મહેનતને શ્રીસમાજ વતી સચોટ રીતે બિરદાવવામાં આવી અને યુવા કાર્યકર્તાઓને સમાજ સેવાની મળેલી તકને કેવી રીતે ન્યાય આપી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

ત્યારબાદ જનરલ સેક્રેટરી ભરત

કેન્દ્રીય યુવાસંઘ ટર્મ ૨૦૨૩-૨૫ ના સેન્ટ્રલ જનરલ સેક્રેટરી એવા Dr. વિપુલ છાભૈયા, નરોડા અને દહેગામ

છાભૈયાએ સભામાં ઉપસ્થિત સર્વે માટે મંતવ્યો અને સુજાવ આપવા મંચ ખુલ્લો મુક્યો, જેમાં ભારતભરના અનેક સદસ્યોએ પોતાના વિચારો, પ્રતિભાવો તેમજ સૂચનો ખુમારીથી સભા સમક્ષ પ્રસ્તુત કર્યા. ત્યારબાદ જનરલ સેક્રેટરી પોતાના કાર્યકાળ ૨૦૨૧-૨૦૨૩ સ્વર્ણિમ ટર્મના સભામાં આખરી ઉદબોધનમાં યુવાસંઘ સાથે જોડાયેલા સર્વેનો લાગણીશીલ થઈને આભાર વ્યક્ત કરીને આવનારી ટીમને શુભેચ્છાઓ પાઠવી.

ત્યારબાદ મિશન ચેરમેન નટવર

કેન્દ્રીય પસંદગી સમિતિ ના સદસ્યો સાથે નવા વરાયેલ ૨૦૨૩/૨૫ કેન્દ્રીય યુવાસંઘ ના હોદ્દેદારો...

સામાણી એ પોતાના જોશીલા અંદાજમાં પોતાના ૧૫ વર્ષના કાર્યકાળને વાગોળતા પોતાનું આખરી વક્તવ્ય આપ્યું, જેમાં તેઓએ પોતાના અનુભવોના નિચોડને સભા સમક્ષ મુકી તેમના જીવનમાં યુવાસંઘ ની પરિવાર સમી ભૂમિકાને અશ્રુભીની યાદો સાથે સરખાવી સૌ ઉપસ્થિત યુવાઓને મળેલી જવાબદારીને પુરા ખંતથી નિભાવવાની સલાહ આપી.

ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી આખરી રજુઆત કરવા સેન્ટ્રલ પ્રેસિડેન્ટ હિતેશ રામજીયાણી ને આમંત્રણ આપવામાં આવ્યુ, જેમાં પોતાના બે વર્ષના કાર્યકાળની સફરને પોતાના આગવા અંદાજમાં સૌ સમક્ષ મૂકી, એમની પુરી ટિમ સાથે સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

મુક્ત મંતવ્યોના દોરમાં આવેલા સુચનો ઉપર આવનારી નવી ટિમ કાર્ય કરે એવો ભાવ વ્યક્ત કરી એમના કાર્યકાળનું સૌથી લાંબુ તેમજ સચોટ વક્તવ્ય આપી સૌનું ફરી એક વખત દિલ જીતી લીધું.

ત્રિદેવ મંદિર પરિસર માં સ્થાનિક તેમજ અન્ય રાજ્યમાંથી કર્મઠ સ્ત્રીશક્તિ ની વિશેષ ઉપસ્થિતિ રહેલ..

પોતાના ગૌરવવંતા ૨૦૨૧-૨૦૨૩ જે સ્વર્ણિમ કાર્યકાળ ને પૂર્ણ જાહેર કરી પ્રેસિડેન્ટ દ્વારા ગૌરવ પૂર્વક આખી ટીમને મંચ પર ઉપસ્થિત કરી સભાનું અભિવાદન જીલ્યું. ત્યારબાદ સૌ હોદેદારોને મોમેન્ટો આપી સફળતાપૂર્વક બે વર્ષના અદભુત કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યા.

જનરલ સભામાં ઉપસ્થિત ભારત ભર નાં યુવા મંડળ થી રીજીયન માં પસંદગી માપી ને આવેલ CCM વૈશ્વિક કાર્ય પ્રણાલી મુજબ યુવા મંડળ ને સિસ્ટમ આપવામાં આવી.

ટીમના IPP સ્વ. વસંતભાઈ ધોળુ નું સન્માન સ્વીકારવા એમના દીકરા ધૈર્ય ધોળું ને અનુરોધ કરવામાં આવ્યો ને આખી સભા જાણે વસંતભાઈની જીવનયાત્રાને નત મસ્તક થઈને ગમગીનીમાં સરી પડી તે વેળા ડિજિટલ સ્ક્રીન પર તેના યુવા ઝરમર ને ppt દ્વારા રજૂ કરવામાં આવેલ જેમાં તેના ઉત્સાહ નાં અનેક સ્પંદન ની અનુભૂતિ કરી.

આ સભા બાદ દરેક રીજીયન ની પસંદગી સમીતી દ્વારા નિમણુક થયેલ તેવા CCM તરીકે અત્રે પધારેલ યુવાઓ ને પદભાર પ્રાપ્ત કરી કાર્ય સંભાળવા નો ઉત્સાહ અનેરો હોઈ આગળનો દોર સંભાળવા પસંદગી સમિતિને મંચ પર આવવા અનુરોધ કરવામાં આવ્યો. સમિતિના પ્રમુખ માવજીભાઈ દિવાણીએ સમિતિની પ્રક્રિયાની પ્રસ્તાવના બાંધી ને આગળનું સંચાલન કરવા સમિતિના મંત્રી મોહનભાઇ ધોળુ ને વિનંતી કરી.

સૌની આતુરતાનો સમયસર અંત લાવવા મંત્રીએ નવી વરાયેલી ટીમની જાહેરાત શરૂ કરી. નામોની ઘોષણા નીચેથી ઉપરના ક્રમમાં કરવામાં આવી એટલે ૧૩ ટિમના કન્વીનર અને PDO થી શરૂ કરી ને ઉત્કૃષ્ટ થીમ લીડર્સને મંચ પર બોલાવવામાં આવ્યા.

ત્યારબાદ જોઇન્ટ ટ્રેઝરર, ૦૬ કાઉન્સિલના સેક્રેટરી, કેન્દ્રીય સેક્રેટરી, મુખ્ય ટ્રેઝરર, પ્રવક્તા PRO, જનરલ સેક્રેટરી, ૦૬ કાઉન્સિલના પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ જુસ્સાભેર જાહેરાત કરીને મંચ પર બોલાવાયા અને સભાએ સમિતિની દરેક પસંદગીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. ત્યારબાદ સેક્રેટરીએ નવી વરાયેલી ટીમને આવનારી ટર્મમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવડાવી અને સાંકળ બનાવી ટીમમાં સંગઠનની

કેન્દ્રિય સમાજ ના મહા સચિવ પરસોતમ ભગત દ્વારા યુવાઓ ને પોતાના નેતૃત્વમાં પણ યુવાસંઘ નાં અનેક કાર્યક્રમાં થયા તેમાં તેઓ સાથે હતા જણાવ્યું.. ખાસ દશાબ્દી મહોત્સવ નિમિતે અને ઉમિયા માતા સંસ્થાન વાંઢાય નાં અમૃત મહોત્સવ કાર્ય ને ખુબ સારહનીય રીતે ઉજવવામાં યુવાસંઘ નો ઉત્તમ અભિગમ રહ્યો.. તેઓ એ વધુ માં જણાવ્યું અભ્યાસુ યુવાઓ ની ટીમ હટકે કાર્ય કરશે .

ભાવના જગાડી.

ત્યારબાદ નવા વરાયેલા જનરલ સેક્રેટરી ડૉ.વિપુલ છાભૈયા ને વક્તવ્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓના પ્રથમ જુસ્સાભેરના વક્તવ્યથી એમને નવી ટીમના પ્રતિનિધિ તરીકે અદભુત પ્રભાવ પાડ્યો.

ત્યારબાદ નવા વરાયેલા યુવાસંઘ ૨૦૨૩-૨૦૨૫ ટીમ નાં CA પંકજ પારસિયા એ પોતાના આવનારી ટર્મના આગવા લક્ષ્યો રજૂ કરતા કહ્યું કે હવે યુવાસંઘને પાછું ઘરે ઘરે પહોંચવું છે અને વ્યસન મુક્તિને મુખ્ય અભિયાન બનાવવું

ગત ટર્મ માં કોઈ મહિલા શકિત ને ટીમ માં સમાવેશ કરવામાં આવેલ નહિ આ ટીમ માં ડોક્ટર મુક્તિ લીંબાણી ને સેન્ટ્રલ સેક્રેટરી પદ નિયુક્તિ કરવામાં આવેલ છે. ડોક્ટર મોહનભાઈ છાભૈયા ની દીકરી જેમણે બચપણ થી અનેક યુવા કાર્યકરને પોતાના ઘરે આવતા જોયા છે અને પોતાના ગુણ જ ઉત્તમ હોય તેઓ આ પદ નિયુક્ત કરવામાં આવેલ છે..

છે, એમની ધારદાર વાણીમાં એમને એટલા અસરદાર હેતુઓ સભા સમક્ષ રજૂ કર્યા કે સૌની સેન્ટ્રલ પ્રેસિડેન્ટ પ્રત્યેની અપેક્ષાઓ આપમેળે સંતોષાઈ ગઈ.

અંતમાં આભાર વિધિ કરવાની જવાબદારી નવા નિમાયેલા સેક્રેટરી ડૉ.મુક્તિબેન લીંબાણીને સોંપવામાં આવી અને તેઓએ પોતાની આગવી શૈલીમાં ટૂંકમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌનો દિલથી આભાર માન્યો.

ખાસ કરીને પસંદગી સમિતિ ના માવજી ભાઈ દિવાણી- નાશિક, મોહન ભાઈ ધોળુ- પેટલાદ, રવિલાલ ધોળુ -ગોવા, નરશીભાઈ ભાવાણી -પુણે, રમેશભાઇ રવાણી -બેંગલોર, ભવાનભાઈ જાદવાણી- સુરત, શાંતિલાલ દડગા -વડોદરા, અંબાલાલ પોકાર -ગાંધીધામ આદિ નો આભાર માન્યો .

ત્યારબાદ સમગ્ર આયોજન ને ખૂબ જોરદાર અને અસરદાર રીતે કરનાર સરદાર પટેલ રીજીયન ની સંપૂર્ણ ટીમ નો કેન્દ્રીય યુવાસંઘ તરફથી અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો, અને આ સંપૂર્ણ સભા અને એવોર્ડ સેરેમની ના દાતા

કેન્દ્રીય યુવાસંઘ ની ૨૦૨૩-૨૫ ટર્મ ની નિયુક્ત ટીમ નો ગ્રૂપ ફોટો સાથે કેન્દ્રીય પસંદગી સમિતિ માં સિનિયર લીડર..

એવા શ્રી કૃણાલ દિલીપ ભાઈ સેંઘાણી (ઉમાં પ્રોજેક્ટ્સ મહાલક્ષ્મી) -ગાંધીનગર

કેન્દ્રીય યુવાસંઘ ૨૦૨૧-૨૩ ની ટીમ નાં મુખ્ય નેતૃત્વ નું આપણા કેન્દ્રીય સમાજ ના મહામંત્રી પુરુષોત્તમભાઈ ભગત સાથે નો એક ગ્રૂપ ફોટો.

નું કેન્દ્રીય યુવાસંઘ તરફથી દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.

આ રીતે સ્વર્ણિમ ટીમે ગૌરવપૂર્વક કાર્ય પૂર્ણ કર્યા નો ભાવ પ્રગટ કરી અને આવનાર કાર્યકાળ ને ભૂતકાળ સાથે નાં સરખાવી નવા સર્જનાત્મક કાર્ય કરવાની ઉતેજના બનાવી આભાર સહ ટીમ ગઠન કરવા અનુરોધ કરવામાં આવેલ.

અદમ્ય જુસ્સા સાથે નવી ટીમને આવનારી ટર્મની કાર્યવાહી સોંપાઈ.

આવો ઓળખીએ ચૈતન્ય- સ્ફૂર્તિ -ઉત્સાહ નાં ૧૮ માં કદમ ને.. પદધમેં - સેન્ટ્રલ પ્રેસિડેન્ટ યુવાસંઘ ૨૦૨૩

નામ: સીએ પંકજ રમેશભાઈ પારસીયા
વતન: સાંયરા (યક્ષ)
હાલે: નરોડા, અમદાવાદ
અભ્યાસ: એમ. કોમ., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
YSK આઈડી: ૧૬૫૦
માતા: પિતા જશોદાબેન અને રમેશભાઈ હરજીભાઈ પારસીયા
સહચારીણી: દિપાલી પારસીયા (અભ્યાસ: બી.કોમ., એલ.એલ.બી.)
YSK આઈડી: ૯૬૭૪
પુત્રી: જીયા (અભ્યાસ: 9th CBSE)
પુત્રી: પાર્થી (અભ્યાસ: 6th CBSE)
ભાઈ: ગીતેશ રમેશભાઈ પારસીયા (અભ્યાસ:એમ.કોમ.)YSK આઈડી: ૫૭૬૩
ભાઈની પત્ની: પ્રવિણા પારસીયા (અભ્યાસ: 12th) YSK આઈડી: ૯૬૭૫
ભત્રીજો: શિવાંશ (અભ્યાસ: 10th CBSE)
ભત્રીજી: ગાથા ((અભ્યાસ: 6th CBSE)
પંકજ પારસીયાં
જન્મતારીખ: ૧૮/૦૭/૧૯૮૦,
જન્મસ્થળ: નાગપુર
રહેઠાણનું સરનામું:
એ- ૬૦૩, ફોર્ચ્યુન હાઈટ્સ, હંસપુરા રેસીડેન્સી પાછળ, નરોડા-દહેગામ રોડ, હંસપુરા, નરોડા, અમદાવાદ- ૩૮૨૩૩૦, ગુજરાત.
વ્યવસાય:
એચ. પી. એન્ડ કપની. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
ઓફિસનું સરનામું:
૬૧૫ થી ૬૧૯, છઠો માળ, શિવમ આર્કેડ, સમૃદ્ધિ બીઝનેસ હબની સામે, નરોડા- દહેગામ રોડ, હંસપુરા, નરોડા, અમદાવાદ-૩૮૨૩૩૦, ગુજરાત.
અન્ય વ્યવસાય:
દિવ્ય એન્ટરપ્રાઈઝ (એશિયન પેઈન્ટ્સ એડેસીવ ડીસ્ટ્રીબ્યુટર)
પેન્થર માર્કેટિંગ (સોલ ડીસ્ટ્રીબ્યુટર ઓફ પેન્થર બ્રાંડ)
જી.આર.ઇન્વેસ્ટમેન્ટ(શેરખાનફ્રેન્ચાઇઝી)

પંકજ પારસીયા, CA, દિપાલી પારસીયા, L.L.B

નાગપુર, મહારાષ્ટ્ર ખાતે એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ થયો. પ્રાથમિક અભ્યાસ ધોરણ ૦૬ સુધી નાગપુર ખાતે કર્યો.

ત્યારબાદ ધંધાર્થે ગુજરાતના આણંદ જીલ્લાના ભાલેજ ખાતે સ્થળાંતર થયું. માધ્યમિક અભ્યાસ ભાલેજ ખાતે થયો. વળી પાછુ ધંધાનું સ્થળ બદલાતા ખંભાત ખાતે પરિવાર શિફ્ટ થયો.

ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ અભ્યાસ ખંભાત ખાતે થયો. ૨૦૦૦ના વર્ષમાં સી.એ. અને એમ.કોમ.ના અભ્યાસ માટે અમદાવાદ આવવાનું થયું. આ દરમ્યાન પરિવાર કચ્છના વિથોણ ખાતે સ્થાયી થયો.

સી.એ.નો અભ્યાસ વર્ષ ૨૦૦૫માં પૂર્ણ કર્યો. સી.એ. થયો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે સન્માન થયું.

વર્ષ ૨૦૦૬થી નરોડા ખાતે ઓફીસ ચાલુ કરી અને પરિવાર નરોડા ખાતે સ્થાયી થયો. આ દરમ્યાન ઘણા ઉતાર ચડાવ જોયા. સી.એ.ના અભ્યાસ અર્થે જયારે અમદાવાદ આવવાનું થયું ત્યારે ઘણા બધાએ નેગેટીવ પ્રતિભાવો પણ આપ્યા.

પરંતુ પરિવારના સહકાર થકી ધ્યેય સિદ્ધ થયો જેનું પરિણામ આજે ભોગવી રહ્યા છીએ. હજુ પણ સંયુક્ત પરિવારમાં જ વસવાટ કરીએ છીએ. સંયુક્ત રીતે જ વ્યવસાયનું ભારણ ઉપાડીએ છીએ.

સામાજિક જવાબદારી નિભાવવા માટે પરિવારનો સહકાર ખૂબ જ જરૂરી છે. નાના ભાઈ ગીતેશ દ્વારા આ માટે ખૂબ જ સહકાર મળ્યો છે. તે પોતે પણ નરોડા યુવા મંડળમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે. માતા, પિતા, પત્ની અને બાળકો પણ સામાજિક જવાબદારી અદા કરવામાં હમેશા ટેકો આપતા રહ્યા છે.

વર્ષ ૨૦૦૦માં જુન મહિનામાં સી.એ.ના અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યો ત્યારે પહેલા જ દિવસમાં બે ઘટનાઓ એવી ઘટી કે જેણે વિચારસરણી બદલી નાખી. સમાજસેવાના બીજ એ બે ઘટનાઓ દ્વારા રોપાયા. સમય જતા એને વેગ મળતો ગયો. યુવામંડળમાં સેવા આપતા પહેલા રીજીયન અને સેન્ટ્રલ યુવાસંઘમાં જોડાવાનો મોકો મળ્યો.આ સમય દરમ્યાન જવાબદારીનું વહન કરવાની ક્ષમતા કેવી રીતે કેળવવી એ સુપેરે શીખવા મળ્યું. નવા મિત્રો મળ્યા.

કેટલાક અંગત મિત્રો બન્યા તો કેટલાક માર્ગદર્શક તરીકે સાથે રહ્યા. મેનેજમેન્ટના પાઠ પણ આ સમાજસેવા થકી જ શીખ્યો. ૨૦૧૦માં શરુ થયેલી આ સફર ૨૦૨૩માં યુવાસંઘના પ્રેસિડેન્ટ સુધી પહોચી છે. આ ટર્મ દરમ્યાન સમાજના દરેક ઘર સુધી પહોચવાની અદમ્ય ઈચ્છા છે. સંપર્ક યાત્રા અને મોદ પરિષદો થકી જન-જનના હૃદય સુધી પહોચવું.

સમાજ અને યુવાસંઘની યોજનાઓની માહિતી જન-જન સુધી પહોચાડવાનો પ્રયાસ કરીશું.

જયારે પરિવારનો આધારસ્તંભ આપણી વચ્ચેથી વિદાય લઈ જાય છે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે તે આપણે સૌ જાણીએ છીએ. યુવા સુરક્ષા કવચ થકી સમાજના દરેક પરિવારને સુરક્ષિત કરીશું. એજ રીતે મારો સમાજ વ્યસન મુક્ત સમાજ હોવો જોઈએ. વ્યસનને લીધે કેટલાય ઘર બરબાદ થતા જોયા છે. આ પરિસ્થિતિ ક્યાંય પણ ના સર્જાય તે માટે પ્રયાસ કરવાની ઈચ્છા છે. વડીલો દ્વારા સર્જાયેલ સંસ્કારો નું સિંચન અનેક યુવાઓમાં થાય તે હેતુથી વડીલો સાથે સંકલન સાધી બધા કાર્યોમાં સફળતા મેળવીશું.

આજના યુવામાં સામાજિક અને આધ્યાત્મિક ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવો છે. આપણો યુવા રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્થાન મેળવે એવા પ્રયાસ કરવા. ઘણું બધું કરવું છે પણ એ કહેવા કરતા કરીને બતાડીશું.

સામાજિક પથયાત્રા:

શ્રી નવયુગ યુવા મંડળ, નરોડામાં નીચે મુજબ સેવા આપેલ છે.
વર્ષ ૨૦૧૩-૧૪ કારોબારી સભ્ય
વર્ષ ૨૦૧૪-૧૫ ખજાનચી
વર્ષ ૨૦૧૫-૧૬ ઉપપ્રમુખ
વર્ષ ૨૦૧૬-૧૭ મહામંત્રી
વર્ષ ૨૦૧૭-૧૮ પ્રમુખ
વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધી સલાહકાર તરીકે સેવા આપી રહ્યો છું.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘમાં નીચે મુજબ સેવા આપેલ છે.
વર્ષ ૨૦૧૦-૧૨
મહાત્મા ગાંધી રીજીયન સ્પોર્ટ્સ કન્વીનર
વર્ષ ૨૦૧૨-૧૪
સ્પોર્ટ્સ કાઉન્સિલ પીડીઓ (નર્મદા કાઉન્સીલ)
વર્ષ ૨૦૧૪-૧૬
સેન્ટ્રલ સ્પોર્ટ્સ કન્વીનર (હૈદરાબાદ ઓલમ્પીયાડ)
વર્ષ ૨૦૧૬-૧૮
સેન્ટ્રલ ખજાનચી (એ.બી.કે.કે.પી યુવાસંઘ)
વર્ષ ૨૦૧૮-૨૧
સેન્ટ્રલ સ્પોર્ટ્સ કન્વીનર (હિમતનગર ઓલમ્પીયાડ)
વર્ષ ૨૦૨૧-૨૩
કાઉન્સિલ પ્રેસિડેન્ટ (ગ્રીનલેન્ડ કાઉન્સીલ)
વર્ષ ૨૦૨૩-૨૫
સેન્ટ્રલ પ્રેસિડેન્ટ (એબીકેકેપી યુવાસંઘ)

વધુ કાર્ય નાં કર્મઠ ભાવે પદધર્મે અદા કરીશ પણ આપ સહુનો સાથ અનિવાર્ય છે. જેમાં સફળતા તમારા શિરે પાઘડી સ્વરૂપે.. જોવા માંગુ છુ ..

ઈસરો ચીફ પર અચાનક આફ્રિકાથી આવ્યો ફોન

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના ચીફ એસ. સોમનાથને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ ઈસરો ચીફ એસ સોમનાથને સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગથી ફોન આવ્યો હતો. પીએમ મોદીએ તેમને કહ્યું કે 'તમારુ નામ સોમનાથ જે ચંદ્ર સાથે જોડાયેલું છે.

દક્ષિણ ધ્રુવ માં પ્રથમ વખત ભાઇ ને મોકલી રાખડી...

ભારત ને ધુતારા.. અંધશ્રદ્ધાળુ, કાળા જાદુ અને પછાત દેશ તરીકે ઓળખ આપનાર આજે દંગ રહી ગયા છે...

સવાલ ચંદ્રયાન મિશન ની સફળતા કે અસફળતા કરતા પણ સહુ થી મહત્વ ની બાબત એ છે કે આપણે જે ચેલેન્જ ઉપાડી છે.. અને તેને માટે આપણે જે પ્રયત્નો કર્યા છે.. જે કૌશલ્ય બતાવ્યું છે.. જે બુદ્ધિમત્તા બતાવી છે.. તેનાથી વિશ્વભરના વૈજ્ઞાનિકો દંગ રહી ગયા છે..

આપણે તો કદાચ ફટાકડા ફોડી જશ્ન મનાવશું પણ ધરતી ઉપર રહી ને સંચાલન કરી મિશન ને સફળ કરનાર આપણા વૈજ્ઞાનિકો આ મિશન ની નાના માં નાની બાબત, મુશ્કેલીઓને કેટલી બારીકાઇ થી સમજ્યા હશે.. મુશ્કેલીઓ ના નિવારણ માટે કેટલું મગજ કસ્યું હશે.. વિચારજો..

બજેટ ને પણ ધ્યાન માં રાખી ને જે મિશન ને સફળ બનાવ્યું તે બારીકાઇ થી અભ્યાસ કરજો ત્યારે એવા ઈસરો નાં તમામ વૈજ્ઞાનિક સાથે ભારત ની વર્તમાન સરકાર નાં વાળા પર પણ ખૂબ માન ઉત્પન્ન થશે. વિજ્ઞાનિકો ને વંદન

વિભિન્ન રીજીયન મિશન અભિમન્યુ ના ચાર ચરણ સત્ર અહેવાલ

તા: 16 થી 20 ઑગસ્ટ 2023ગત સપ્તાહમાં અધિકતમ સક્રિય સંયોજક તથા પ્રશિક્ષક બહેનોના નામ સાથે એમના સત્રની નવીનતા તથા જાણકારી

(૧) મિશન અભિમન્યુનો દ્વિતીય ચરણ (બાળ સંસ્કાર શિક્ષણ) મિશન ના દ્વિતીય ચરણના સત્ર અંતર્ગત આ સપ્તાહમાં પ્રશિક્ષક બહેનો દ્વારા આપણા સમાજના ભવિષ્ય - મિશન શિષ્યો ને સનાતન ધર્મની સમજ આપેલ. ત્યારબાદ શ્લોક, સ્તુતિ તથા મંત્રો, ઓમનાદ નો અભ્યાસ કરાવવામાં આવ્યો. વિશેષમાં આ સપ્તાહ રાષ્ટ્રીય પર્વના સંજોગોવસાત 15 મી ઓગસ્ટની ઉજવણી કરાવવામાં આવી. જેમાં ધ્વજા રોહણ કરાવવામાં આવ્યું .

સર્વે અભિમન્યુએ ગીત, કવિતા,ડાન્સ ,સ્પીચની સુંદર પ્રસ્તુતિ આપી. આપણા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. તેમજ બાળકો એ આઝાદી વિષય માહિતી આપેલ.

સ્વાતંત્ર દિવસના ઉપલક્ષમાં સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન ને યાદ કરી એમને નત મસ્તક વંદન કર્યા. દેશભક્તિ ગીતો ગાયા.

ત્યારબાદ શ્રાવણ માસના મહિમા ને સમજાવતા જ્યોતિર્લિંગ ની વિસ્તૃત માહિતી આપી અને પ્રશ્નોત્તરી કરવામાં આવેલ.અંતે રાષ્ટ્રગીત ગાઇ અને ભારત માતાના જયકાર અને વંદે માતરમ ની ગુંજ સાથે સમાપન કરાવવામાં આવ્યા.

ગુરુરૂપે સેવા આપનાર પ્રશિક્ષક બહેનો -
(MUR) ઠાકુર્લી (ડોમ્બીવલી)-
પ્રીતિ ભગત, ગીતા પોકાર.
(MUR) વૈભવ નગરી -
નિશા પોકાર , નીતા દિવાણી, વર્ષા ચૌધરી, વર્ષા વેલાણી, રીના પોકાર
(MUR) પાંડુરંગવાડી-
પ્રીતિ ભગત ,સ્વાતિ દિવાણી, પ્રવીણા સેંગાણી, હેતવી સેંઘાણી, અલ્પા ભીમાણી ,કલ્પના રંગાણી, જિનલ ભીમાણી.
(MUR) ગોગરસવાળી -
નેહા લીંબાણી, કૃપા વેલાણી , વૈશાલી વેલાણી,છાયા ધોળું , પ્રવિણા સેંગાણી.
(MUR) સાગાવ -
પ્રીતિ ભગત, ગીતા છાભૈયા, શીતલ છાભૈયા, સીમા રંગાણી , કિંજલ સાંગાણી ,પાયલ દિવાણી.
(MUR)-નાંદીવલી
પ્રીતિ ભગત ,હંસા સેંગાણી , ગીતા પોકાર, ભાવના ભીમાણી.
(DKR) Online સત્ર
પુનીતા રામાણી, રુચિ માકાણી.
(DKR) દાવણગીરી-
શારદા લીંબાણી ,ભાવના પોકાર , સીમા લીંબાણી, હંસા લીંબાણી.
(CSR) પીમ્પરી ચીંચવડ-
નિમીક્ષા લીંબાણી, હેમાલી છાભૈયા, બીના છાભૈયા,સંગીતા લીંબાણી ચંદ્રિકા છાભૈયા.
(SBR) હિંમતનગર-
શ્વેતા દીવાણી,શ્વેતા માકાણી , રીન્કુ છાભૈયા ,માનસી પોકાર, ગાયત્રી દિવાળી.
(VDR) બાલાઘાટ
ગીતા ખીમાણી,જમના ખીમાણી, મમતા ખીમાણી,રીતા છાભૈયા.
(TAP) સિકંદ્રાબાદ કુકડપલી વિભાગ
રચના ચૌધરી
(SPR), પેટલાદ
જયશ્રી લીંબાણી,કોમલ પોકાર, પરિ ભાવાણી.
(MUR) ડોમ્બીવલી -
પ્રીતિ ભગત ,ગીતા પોકાર
(UKR) -
રુચિતા ચૌહાણ, સાવિત્રી ભાવાણી, રશ્મી ભાદાણી, હેતલ સાંખલા, હેતલ દિવાણી.
(DGR), ઉમાભવન અંકલેશ્વર-
રાધા મૈયાત,રૂપા લીંબાણી, શીતલ ભગત,મિત્તલ લીંબાણી, નિયતિ ભગત,હીના વાગડિયા.
(DKR) મૈસુર રોડ-
શીલા વેલાણી, જિજ્ઞા વાસાણી, હર્ષા વેલાણી, રશ્મી ચૌહાણ, ભાવના સુરાણી.

(૨) મિશન અભિમન્યુ ચતુર્થ ચરણ - મિશન વિવેકાનંદા હેતુ યુટ્યૂબ ચેનલ માટે ઓડિયો ક્લિપ ની સેવા
1) ભાવનાબેન નિશાંત ભાવાણી,
રાજનંદગાવ, છત્તીસગઢ
વિષય : શું આપણી મુક્તિ આપણા હાથમાં છે?
2) ડૉ. કૃષ્ણા વિશાલ લીંબાણી,
વડોદરા, ગુજરાત
વિષય : વિટામિન ડી નો સ્તોત્ર - સૂર્યપ્રકાશ ના અદભુત લાભ
3) ગીતાબેન લીંબાણી,
ડોમ્બિવલી, મુંબઈ
વિષય : શ્રાવણ માસની મહિમા
મિશન સંયોજક : પુનીતા રામાણી બેંગલુરુ

સમસ્ત રામાણી પરિવાર જોગ

જય ઉમિયા સહ જણાવવાનું કે તા:1.09.2023 ને શુક્રવારના બપોર બાદ 3.30 કલાકે પરિવારની કારોબારી મીટીંગ આઈ શ્રી રૂડીમાતા ના સ્થાનકે રામાણી પરિવારના મા. પ્રમુખશ્રી શિવગણભાઈ વેલજી રામાણીના પ્રમુખ સ્થાને મીટીંગનું આયોજન રાખેલ છે.

આ મીટીંગમાં રામાણી પરિવારના સૌ કારોબારી સભ્યો તથા વિવિધ સમિતિઓના સર્વે સભ્યોને અચૂક હાજર રહેવા આ મેસેજથી જાણ કરવામાં આવે છે.

લી.
શીવગણ વેલજી રામાણી-પ્રમુખશ્રી
બાબુભાઈ દેવજી ધનાણી-મહામંત્રી શ્રી.

અખિલે ભારતને ઓલિમ્પિક-2024નો પાંચમો શૂટિંગ ક્વોટા મેળવ્યો

ભારતીય શૂટર અખિલ શિયોરાને ભારતને 11મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો છે. તેણે બાકુમાં ચાલી રહેલી વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 50 મીટર 3 પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો.

એટલું જ નહીં, તે પુરુષોની 50 મીટર 3 પોઝિશન રાઈફલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો. શૂટિંગમાં ભારતનો આ પાંચમો ઓલિમ્પિક ક્વોટા છે અને આ ઇવેન્ટમાં બીજો ઓલિમ્પિક ક્વોટા છે.

અગાઉ, આ ઇવેન્ટમાં, સ્વપ્નિલ કુસાલેને ગયા વર્ષે ક્રોએશિયા વર્લ્ડ કપમાં પ્રથમ ક્વોટા મળ્યો હતો.

માંડવીના 5 યુવાનો, એક યુવતી સેનામાં જોડાયા

સરહદી કચ્છના મહત્તમ યુવાનો દેશની રક્ષા કાજે સેનામાં જોડાય છે ત્યારે કચ્છના વધુ 6 યુવક-યુવતી સેનામાં પસંદગી પામ્યા છે. માંડવીની એસ. વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 6 પૂર્વ એનસીસી કેડેટ્સની સીઆરપીએફ અને બીએસએફમાં ભરતી થતા આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

"મહાત્મા ગાંધી રીજીયન પ્રેરિત કુજાડ મહિલા શક્તિ દ્વારા આયોજીત એક દિવસીય પ્રવાસ નું આયોજન"

"હે મનુષ્ય આ સુંદર દુનિયાની સફર કર, જીંદગી પછી રહેવાની નથી,જીંદગી રહેશે તો , જુવાની કાયમ ક્યારેય પણ રહેવાની નથી.

શાયર ની આ પંક્તિઓ આપણને જીવનમાં પ્રવાસનું મહત્વ સમજાવી જાય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતા એકધારા જીવનમાં ઉત્સવો, પ્રસંગો, મેળાઓ અને પર્યટન જેમ આનંદમય અને યાદગાર બનાવે છે.

માનવજીવનમાં પ્રવાસનું હંમેશા આગવું સ્થાન રહ્યુ છે પછી તે આદિમાનવ નો સમય હોય કે અત્યારની આધુનિક ટેકનોલોજીનો સમય હોય.

જીવનના દરેક તબક્કે પ્રવાસનું એક અલગ જ મહત્વ રહેલું છે.પ્રવાસ શબ્દ સાંભળતા જ અલગ - અલગ કેટલાય ચિત્રો મનમાં ઉપસી આવે, મન નાચી ઉઠે અને પગ ઉતાવળા થઈ જાય. એટલો વિશાળ શબ્દ કે એનો અર્થ ટુંકમાં સમજાવવો ખૂબ જ મુશ્કેલ લાગે. તેમ છતાં પ્રવાસ નો અર્થ કહેવો હોય તો સ્થળે સ્થળે ફરવું.

ફક્ત ફરવું જ નહિ પરંતુ સ્થળને જાણવું, માણવું અને થોડા સમય માટે એને મન ભરીને જીવી લેવું એનું નામ "પ્રવાસ". આવો જ એક સુંદર મજાના પ્રવાસ નું આયોજન "નર્મદા કાઉન્સિલ" નાં "મહાત્મા ગાંધી રીજીયન" માં આવેલ "કુજાડ સમાજની મહિલા શક્તિ" દ્વારા વન ડે પિકનિક નું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ:- 20/08/2023 ને રવિવાર નાં સવારે 5:00 વાગે કુજાડ સમાજવાડી થી પ્રવાસ બસ નું પ્રસ્થાન કરવામાં આવ્યું અને 6 વાગે અમદાવાદની ધરોહર સમા સૂર્ય મંદિરે પહોંચ્યા ત્યાં મંદિર નાં દર્શન કરી ચા નાસ્તા ની મજા માણી ત્યારબાદ ત્યાંથી આ મહિલા મંડળ 10 વાગે બહુચરાજી માતાના નાં મંદિરે પહોંચીને માં બહુચર નાં દર્શન કરી પાવન થયા ત્યાંથી શંખેશ્વર માં આવેલ જૈન મંદિર નાં દર્શન કરવા બપોર નાં 12 વાગે પહોંચ્યા દર્શન કર્યા બાદ ત્યાંજ મધ્યાહન ભોજન પ્રસાદની મજા માણી.

થોડો સમય આરામ કર્યા બાદ આ પ્રવાસ 3:00 વાગ્યા ની આસપાસ પાટડી વર્ણિન્દ્ર ધામ માં આવેલ સ્વામિનારાણ ભગવાન નાં દર્શન કરી ચા પાણી કર્યા ત્યાંથી આ પ્રવાસ પીપળી ગામમાં આવેલ સુપ્રસિધ્ધ અને ખૂબ જ સુંદર રામદેવપીર નાં મંદિરે દર્શન કર્યા 7:30 કલાકે વાળું કરી પાછા ઘર તરફ પ્રસ્થાન કર્યું.

આ એક દિવસ ક્યારે પસાર થઈ ગયો એની કોઈને કંઈ જ ખબર ના પડી. આવા સુંદર મજાના પ્રવાસ નાં આયોજનમાં 40 નારી શક્તિ એ ભાગ લઈ ધન્યતા અનુભવી.

મહાત્મા ગાંધી રીજીયન
પ્રચાર પ્રસાર (પ્રવકતા) પ્રિતેશ છાભૈયા.

પુરુષોત્તમ માસ માં વરંગલ મહિલા મંડળ દ્વારા આખો મહિનો ભાગવત કથા નું રસપાન

પુરુષોત્તમ માસમાં વરંગલ ગામ ના મહિલા મંડળ ની બહેનો ના માધ્યમ થી હરિભક્તો ને ભાગવત કથા શ્રવણ નો લાભ પ્રાપ્ત થયો. તે સાથે જ વરંગલ સમાજ ની મહિલા મંડળ દ્વારા કરીમ નગર મહિલા મંડળ ને એક દિવસ ના ભક્તિ યજ્ઞમાં શામેલ થવા સાદર આમંત્રણ આપવામાં આવ્યું.

જેથી કરીમનગર સમાજ ને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન અને પૂજન કરવાનો લ્હાવો,અન્નકુટ ના દર્શન નો લ્હાવો ,છપ્પન ભોગ ની પ્રસાદી નો લ્હાવો મળ્યો. વરંગલ મહિલા મંડળ ની પ્રવૃતિઓ જોઈ ને કરીમનગર ના હરિભક્તો એ ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. બન્ને સમાજ ના સર્વે હરિભક્તો એ સાથે મળી ભગવાન ના સંકીર્તન ગાયા તથા સાથે મળી ને રાસ ની રમજટ પણ માણી. અલ્પાહાર કરી છૂટા પડ્યા.

સંયોજક :
માયા રામાણી, કરીમનગર - તેલંગાણા.

બીલીમોરા યુવક મંડળ આયોજીત મોન્સુન પ્રવાસ

શ્રી ક.ક.પાટીદાર સનાતન યુવક મંડળ,બીલીમોરા દ્વારા આયોજીત સપ્તશૃંગી અને સાપુતારા ખાતે મોનસૂન પ્રવાસખુબ સુંદર અને અદભૂત રમણીય વાતાવરણ માં યુવક મંડળના સભ્યો આજના ભાગદોડ અને કોમ્પિટીસન વાળી જિંદગીમાંથી ટેન્સન મુક્ત થાય તે હેતુથી એક દિવસ માટે પોતાના શરીર અને મગજ ને ૧૦૦% ઓક્સિજન વાળા રમણીય વાતાવરણ સાથે આનંદ ઉલ્લાસ મજા પડે તેવી વ્યવસ્થા પ્રવાસ સમિતિ દ્વારા ગોઠવવામા આવેલ.

પ્રવાસ આયોજન દરમિયાન વધઈ અને વાંસદા વચ્ચે આવેલ આકડા ધોધ માં ટ્રેકિંગ કરીને ધોધ સુધી પહોંચી પ્રવાસમા જોડાયેલ સૌ યુવક મિત્રોએ પ્રાકૃતિક ઝરણામાં નાહવાની ખુબ મજા માણેલ.

સમગ્ર આયોજન પ્રવાસ સમિતિના કન્વીનર રાજેશ માકાણી અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ.



સંભાજીનગર સમાજના સાહસી યુવાન જયંતીભાઈ પૈથાણી થી થયેલ ચર્ચા
- સહયોજક : પ્રવિણ નાકરાણી, સંભાજીનગર

અત્રે વસ્તા આ ભાઇને નાનપણ થી અનેક પ્રકાર ની સાહસીક રમતો જેમકે પૅરાગ્લાયડીંગ,ટ્રેકિંગ,રેપલીંગ,રૉક ક્લાઈમ્બીંગ,સાયકલીંગ,જેવી અતી રોમાંચક રમતો રમવામાં બહુજ રસ ધરાવે છે.

માન્સુન માં વરસાદ ને લીધે પૅરાગ્લાઇડીંગ નથી કરી શકાતુ એટલે એ સહયાદ્રી પર્વત માળામાં આવેલ છત્રપતી શિવાજી મહારાજ ના હિંદવી સ્વરાજ્ય ના ગઢ-કિલ્લા ઉપર ટ્રેકિંગ માટે નિકળી પડે છે. અત્યાર સુધી ૫૦ થી ઉપર ગઢ-કિલ્લા ઉપર ટ્રેકિંગ કરી ચુક્યા છે.

એવામાં એમને ખબર મળ્યા કે પુના થી એક ગ્રૂપ વૉટર ફૉલ રેપલીંગ કરવા જવાના છે. તેની બધ્ધી માહિતી મેળવીને એ ગ્રૂપમાં જોડાઇ ગયા.

પુના ની બાજૂમાં આવેલ લવાસા સિટી થી ૧૦ કિ.મી. આગળ લિંગ્યા ઘાટ નામનું સુંદર, ડેમના કિનારે ઘનદાટ જંગલો થી ભરપૂર એવા સ્થળે એક વૉટર ફૉલ આવેલ છે. એ વાટર ફૉલમાંથી દોરી થી ૨૦૦ ફુટ ઉડી ખીણ નીચે ઉતરવાનું સાહસ થી ભરપૂર એવું અભિયાન પુરૂ કરવુ હતું,૨૫ જણ ની ટિમમાં બધાએ સલામત રેપલીંગ કર્યુ.

આ એડવેંચર એક્ટીવિટીમાં જે ભાઇયોને સહભાગી થવું હોય તે આ જયંતીભાઇ પેથાણી થી સંપર્ક સાધી શકો છો.મો.નં. ૯૮૨૨૦૬૭૯૮૯,૯૦૨૨૩૭૯૧૦૬

YSK સહયોગ નિધિ અર્પણ, લક્કડગંજ - નાગપુર

યુવાસંઘ વિદર્ભ રીજીયન માં દિવંગત **સ્વ:મિતુલ ચૌધરી** વિદર્ભ રીજીયન અંતર્ગત આવતા લક્કડગંજ (નાગપુર) સમાજના દિવંગત થયેલ સભ્ય સ્વ.મિતુલ લીલાધર ભાઈ ચૌધરીતેમના નિવાસ સ્થાને ૨૩ ઑગસ્ટના

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ અંતર્ગત યુવા સુરક્ષા કવચ યોજના (YSK) સહયોગ નિધિનો પ્રથમ ચેક ₹ ૫,૦૦,૦૦૦/- નો તેમના વડીલ ભાઈ મહેન્દ્ર લીલાધરભાઈ ચૌધરી ને અર્પણ કરેલ.ચેક અર્પણ કરવા માટે ઉપસ્થિત રહેલ હોદેદારોશ્રીઓ, સમાજના પ્રમુખશ્રી Adv. શાંતિભાઈ પોકાર, મહામંત્રી કાંતિભાઈ દિવાણી, વિદર્ભ ઝોન સમાજના પ્રમુખશ્રી ભીમજીભાઇ સેંઘાણી, યુવક મંડળ ઉપપ્રમુખ તેમજ રીજીયન YSK કન્વીનર ભરત રૈયાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન પોકાર,વિદર્ભ રીજીયનના વાઈસ ચેરમેન શ્રીમતી જ્યોતિ સેંઘાણી , ઓરેન્જ ડિવિઝન ચેરમેન પિયુષ હળપાણી અને રીજીયન PRO કિર્તી સેંઘાણી ઉપસ્થિત રહ્યા હતાં.ઉપરોકત તમામ સભ્યોની હાજરીમાં દિવંગત સભ્યનાં પરિવારજનને સહયોગ નિધિ નો પ્રથમ ચેક અર્પણ કરવામાં આવેલ.

" અપને લીયે નહી,અપનો કે લીયે "
PRO - કીર્તિ સેંઘાણી, નાગપુર

બાલોદ માં ચંદ્રયાન-૦૩ નું સોફ્ટ લેન્ડિંગ સમૂહમાં લાઈવ નિહાળ્યું

બાલોદ (છતીસગઢ) યુવા મંડળ દ્વારા ચંદ્રયાન- 3 સોફ્ટ લેન્ડીંગ લાઈવ બ્રોડકાસ્ટ પ્રોજેક્ટ માધ્યમ દ્વારા સમાજ જનોને નિહાળવા નું આયોજન

શ્રી પાટીદાર ભવન બાલોદ મધ્યે ૨૩ ઑગસ્ટના નવયુવક મંડળ દ્વારા "ચંદ્રયાન -03" ના વિક્રમ લેન્ડર ની ચંદ્રમા સોફ્ટ લેન્ડિંગ થવાનું સંપૂર્ણ લાઇવ બ્રોડકાસ્ટ પ્રોજેક્ટર ના માધ્યમ થી સમાજના સર્વે જનો ને નિહાળવા નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિશેષ રૂપે સમાજના નાનાં-નાનાં વિદ્યાર્થી બાળક- બાળીકાનાં સાથે સાથે સમાજના મંત્રી જયંતીભાઈ રૂડાણી, મહિલા મંડળ પ્રમુખ જયશ્રીબેન માકાણી, નવયુવક મંડળ મહામંત્રી હર્ષદ માકાણી, સેંટ્રલ બિજનેસ સેલ PDO ચેતન માકાણી અને સમાજનાં વડીલ અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સર્વે જનોએ ચંદ્રયાન નાં સંબંધ માં જાણકારી લેવા બાદ સંપૂર્ણ લેન્ડિંગ ની સૌભાગ્યશાળી પ્રક્રિયા ને લાઈવ જોઈ અને આ અવિસ્મરણીય ક્ષણના સાક્ષીદાર બન્યા અને લેન્ડિંગના ક્ષણને 'ભારત માતા ની જય' ના નારા સાથે વધાવ્યું અને વડા પ્રધાન ના સાથે સાથે સંપૂર્ણ ભારતના આ ખુશીના પળમા સામિલ થઈ અને પોતાની ખુશી વ્યક્ત કરી..

નાના-નાના બાળક બાળીકાઓ ને ચંદ્રયાન ના સંબંધ મા સંક્ષિપ્ત જાણકારી આપી અને તેમને ચંદ્રયાન ના ઉદ્દેશ્ય બાબત અવગત કરાવવામાં આવેલ. કાર્યક્રમ ને સફળ બનાવા માટે નવયુવક મંડળ મંત્રી અંકિત માકાણી દ્વારા બાલોદ નવયુવક મંડળ ની ટેકનિકલ ટીમનો વિશેષ સહયોગ સાધુવાદ આપવામાં આવેલ.

બાલોદ- PRO-
ગૌરવ રૂડાણી - રોહન પોકાર

પુષ્પાંજલિ અર્પણ



સ્વ: કાન્તાબેન ગોવિંદભાઈ છાભૈયા, ઉ. વર્ષ- ૭૪
કચ્છમાં ગામ- ભડલી (નખત્રાણા)હાલે બાલેશ્વર (ઓરિસ્સા)

માતૃશ્રી, સ્વ.ગંગાબેન છાભૈયા, જેઓ ગંગાસાગર કાઉન્સિલ યુવાસંઘ પ્રેસિડેન્ટ મુકેશ છાભૈયાના જનની, તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૩ બુધવારના રોજ સવારના ૮.૦૦ વાગ્યે હાર્ટ એટેક આવતા દુ:ખદ અવસાન પામ્યા છે. ભગવાન તેમના આત્માને પરમ શાન્તી આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ વતી.... સાંત્વના પત્ર

તા:23/8/2023
આદરણીય, મુકેશભાઈ, નરેન્દ્રભાઈ અને પ્રકાશભાઈ તેમજ પિતાજી ગોવિંદભાઈ છાભૈયાબાલેશ્વર ઓરિસ્સા

इत्येवोत्तरम्। युधायं हि कुमर कृषतिस्य नियतमग्निहोतरादिवत्।
तच्चदुध संपरहारे इत्यस्माद्वानिरव्यन्नं ।

સ્વ: માતૃશ્રી કાન્તાબેન ગોવિંદભાઈ છાભૈયાના અવસાનના સમાચાર સાંભળી યુવાસંઘ પરિવાર ખૂબ દુ:ખની લાગણી અનુભવી રહ્યો છે. ભગવાન લક્ષ્મીનારાયણ સદગતના દિવ્ય આત્માને તેમના નીજધામમાં સ્થાન આપે એવમ પરિવાર અને સ્નેહીજનો પર આવી પડેલ અત્યંત દુ:ખને સહન કરવાની દિવ્ય શક્તિ આપે તેવી મા ઉમિયા પાસે પ્રાર્થના. આ દુ:ખના સમયે અમો આપસૌ સાથે જ છીએ. દિવ્ય આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ..

ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
ચીફ સેક્રેટરી,તથા સમગ્ર યુવાસંઘ વતી...
ABKKP યુવાસંઘ

અવસાન નોંધ

તારીખ: 24/08/2023	તારીખ 23/8/2023
સ્વ. હિમ્મતભાઈ દાનાભાઈ પોકાર	સ્વ. દેવશીભાઈ હંસરાજભાઈ છાભૈયા
ઉંમર: વર્ષ 54, કચ્છમાં ગામ ધાવડા (મોટા)	ઉંમર: વર્ષ 87, કચ્છમાં ગામ કોટડા (જડોદર)
હાલે આરંગ, રાયપુર	હાલે નવી પનવેલ (મહારાષ્ટ્ર)

તારીખ: 23/8/2023

સ્વ. કાન્તાબેન ગોવિંદભાઈ છાભૈયા	સ્વ.શાન્તાબેન ભવાનજીભાઈ સેંઘાણી
ઉંમર: વર્ષ 74,કચ્છમાં ગામ ભડલી (NKT)	ઉંમર: વર્ષ 84,કચ્છમાં વાલ્કા
હાલે બાલેશ્વર (ઓરિસ્સા)	હાલમાં સાવનેર
સ્વ.અંબાલાલભાઈ ગોવિંદભાઈ હળપાણી	સ્વ. નારણભાઈ માવજીભાઈ સાંખલા
ઉંમર:વર્ષ 75, કચ્છમાં ગામ ગડુલી	ઉંમર: વર્ષ 90, કચ્છમાં ગામ નેત્રા (NKT)
હાલમાં મેઘપર બોરીચી	હાલે વડોદરા

H.K. DOORS
BEAUTIFUL AND STRONG DOORS FOR YOUR HOME
HK DOORS First IMPRESSION of your HOUSE
TERMITE-RESISTANT | FIRE-RESISTANT | DURABLE
HEAD OFFICE
Sri Narayan Timber, Survey No. 186/187, Plot No. 7,8,9, Chudva Gandhidham - 370201, Kutch, Gujarat - India.
Hareshbhai Rudani - Mo. +91 99791 57883
BRANCH OFFICE
1. DHARWAD - KARNATAKA
Kishorbhai - Mo. +91 94826 95508
2. HYDERABAD - TELANGANA
Bhaveshbhai - Mo. +91 78934 59459
3. CHENNAI - TAMILNADU
Vivekbhai - Mo. + 91 98843 12266
Janakbhai - Mo. +91 98413 88663
4. VIJAYWADA - ANDHRA PRADESH
Rajeshbhai - Mo. +91 78428 05202
5. MARGAO - GOA : Kirtibhai - Mo. +91 70202 74705

KishorBhai Rudani: 9979352929
H.K. TIMBER PVT. LTD.
TIMBER IMPORTER AND ORDER SUPPLIERS
HEAD OFFICE
Survey No. 186/187 Plot No. 6
Gandhidham - 370 201, Kutch, Gujarat - India.

PRAMUKH ENTERPRISE
EXPOTER AND TIMBER IMPORTER
HEAD OFFICE
Flat No. 3, Ground Floor, Plot No. 26, Sector - 3, Matru Chhaya Appartment, Gandhidham Kutch, Gujarat - 370 201.
Bharatbhai Rudani - Mo. +91 99791 57884

H.K. FRUITS
HEAD OFFICE
45, Gopalnand Chock, Gunatitpur, Kumbharadi, Kutch, Gujarat - 370 140.
Jagdishbhai Rudani - Mo. + 91 99254 98648
Dhirajbhai Rudani - Mo. + 91 99784 49205